

November 16, 2021

To,
Department of Corporate Services
BSE Limited
Ground Floor, P. J. Tower,
Dalal Street, Fort,
Mumbai- 400 001.

Dear Sir/Madam,

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the half year ended on 30/09/2021.

Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the half year ended on September 30, 2021 as per the Regulation 47(1)(b) and 47(3) of the (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For, Ashoka Metcast Limited

Shalin A. Shah

Shalin A. Shah
Managing Director
DIN: 00297447



Encl: As above

Ashoka Metcast Limited

Reg. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Mithakhali Ahmedabad 380006. **Website:** www.ashokametcast.in
Email : info@ashokametcast.in **CIN :** U 70101GJ2009PLC057642 **T :** 079 26463226

Ahead of VGGs, Gujarat to launch new policies

GANDHINAGAR: To attract investors and boost positive sentiments ahead of the upcoming Vibrant Gujarat global summit scheduled in January 2022, the Gujarat government is set to announce around half a dozen new policies in key sectors like energy, IT/ITES, electronics, and agri-business. Chief minister Bhupendra Patel is likely to announce the policies soon. The government is also expected to approve important long-pending demands made by industries. The state's Information Technology & IT-enabled Policy 2016 will have a larger ambit. It is likely to cover emerging technologies like blockchain, artificial intelligence and robotics. Compared to the 2016 policy where incentives were given to create IT/ITES accommodating properties, the new policy will focus on providing easy entry-and-exit plug-and-play infrastructure on lease. The policy is also expected to offer manpower-related incentives to attract talent and boost the sector's growth. Similarly, the current policy for the electronic industry is also coming to an end this month. To draft the new policy, the state government is consulting large, medium, and small electronic companies to understand their needs and is also studying policies of other states. Like the IT/ITES policy, the government intends to provide incentives to nurture manpower required for the industry. Meanwhile, the state agriculture department has prepared a draft for the new agri-business policy which has proposed to reduce investment criteria from Rs 50 lakh to Rs 35 lakh. It has also proposed reduction of interest subsidy from 7.5% to 7%. This decision has been taken to match the state's industrial policy which offers cost benefits only up to Rs 35 lakh and 7% interest subsidy. "Although financial benefits have been reduced in the proposed policy, it is expected that considering higher demand, more applications will be admitted and more industries will be given benefits," said sources. The energy & petrochemicals department is also working on three key policies namely wind power generation, waste to energy, and small hydro power generation to double power generation from these three sectors.

Gujarat woman booked for cyberbullying

AHMEDABAD: The owner and employee of a printing and book stall have lodged a complaint against a woman from Kutch for allegedly posting photos of the two online and making obscene comments on it. The female employee told police that she accused used to frequent the book stall and was in contact with the owner. "Then, one day, I got a call from a woman, saying that she had made a fake profile on social media, uploaded our photographs on it and made obscene comments. She also told me that she would file a rape complaint against the two of us if we went to the police," the employee said. The owner, police. "When she got to know about it, she called and identified herself. She confessed to the crime but again threatened to lodge a rape complaint against the owner," the employee said. Following this, the two decided to lodge a complaint against the woman with Meghnanagar police on Thursday. The female employee told police that the accused used to frequent the book stall and was in contact with the owner.

Sexual harassment case: Deputy collector suspended in Gujarat



AHMEDABAD: The general administration department (GAD) of the state government on Thursday suspended Mayank Patel, the deputy collector of Modasa in Arvali district, after he was arrested for stalking another government employee and sending her lewd messages. Sources in the GAD said as Patel was arrested by Ahmedabad city cybercrime police on Tuesday, he has been suspended as is the standard procedure of the department. On the other hand, the woman who had accused Patel of sending lewd images to her son, husband and other family members, along with various other offences, was also transferred from her current posting at a taluka panchayat to another department in the state secretariat. Patel was detained by city police on Monday for allegedly harassing the Class 2 government officer with sexual remarks, threats and sending obscene pictures to her family members. According to her complaint filed on Monday, Patel, 28, a resident of Shihora village in Kapadvanj taluka of Kheda district, had met the complainant for the first time in 2016 during a state government event and they later met frequently for work purposes. The complainant had taken her mobile phone number and began talking with her. The complainant and accused later began visiting each other's houses and had good relations.

As Patel began making advances, she started talking to him, which enraged him to the extent that he began harassing her. Patel had nine sim cards, including one government allotted number, using which he had harassed the complainant, pestering her to have a relationship with him. Patel used to interfere in her personal and professional life, due to which she stopped talking with him. He would call her from different numbers and if she did not answer his calls, he would keep calling and sending messages from different numbers, said a police officer. He also allegedly used to get the location of the complainant by misusing his powers and would reach wherever she was to hound her, said a police officer. Patel also began calling her husband and in-laws and threatened them with dire consequences. The complainant's family also approached Patel's family, to try to persuade him not to harass her, but he did not stop. Recently, he sent obscene images of her to her son, husband and father-in-law, after which the complainant approached city police and filed a complaint of sexual harassment. On the other hand, the woman who had accused Patel of sending lewd images to her son, husband and other family members, was also transferred from her current posting at a taluka panchayat to another department in the state secretariat.

Motera society put in containment, second in Ahmedabad in 2 days

AHMEDABAD: The days of micro-containment of housing societies owing to Covid infection is back. One block of a residential society located in Motera in Chandkheda area was declared a micro-containment zone on Friday, a day after Ahmedabad Municipal Corporation (AMC) resumed containment of buildings. In case of the Motera housing society, 20 houses with 76 residents were under quarantine. On Thursday, the civic body had micro-contained a block of a society in Isanpur the first after a gap of six months. AMC had discontinued the practice of putting buildings in micro-containment in the last week of May. Elsewhere, in the state, daily Covid cases halved in the last 24 hours. The five Gujarat cities account for 71% cases. After the spike in daily cases to 42 and 40 in the past two days, the Covid-19 positive cases again dipped on Friday with the state recording 21 cases. Of these, 15 or 71% of the cases were from the five cities. The new Covid positive cases include 6 from Vadodra city, 3 each from Surat city and Valsad, 2 each from Ahmedabad, Jamnagar and Rajkot cities, and 1 each from Unagadh, Kutch and Surendranagar districts. Friday recorded cases from 5 cities and 4 districts.

INDIA INFRASPACE LIMITED
 CIN : L45201GJ1995PLC024895
 Regd. Office: 701, Sarap Building, Opp. Navjeevan Press, Ashram Road, Ahmedabad 380014
 Phone: 079-27544003, Fax: 079-275436815, E-mail: investor@indiaspace.com

Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and Half Year Ended September 30, 2021

Sr. No.	Particulars	Standalone		Consolidated			
		Quarter ending 30-09-2021	Half year ending 30-09-2021	Quarter ending 30-09-2021	Half year ending 30-09-2021		
1	Total Income from operations	0.00	0.00	0.00	2.52	44.02	37.48
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional Items)	(0.44)	(0.80)	(0.30)	(3.21)	(7.45)	(21.28)
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional Items)	(0.44)	(0.80)	(0.30)	(3.21)	(7.45)	(21.28)
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional Items)	(0.44)	(0.80)	(0.30)	(3.21)	(7.45)	(21.28)
5	Total comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period and other Comprehensive Income, after tax)	(0.44)	(0.80)	(0.30)	(3.21)	(7.45)	(21.28)
6	Paid up Equity Share Capital (Face value of INR 10 each)	280.00	280.00	280.00	280.00	280.00	280.00
7	Earnings Per Share (face value of INR 10/- each) (not annualised) - in Basic & Diluted	(0.02)	(0.03)	(0.01)	(0.11)	(0.27)	(0.76)

Notes:
 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com and on the Company website www.indiaspace.com

Place : Ahmedabad
Date : November 12, 2021

For and on behalf of the Board of Directors of India Infraspace Limited
 Prady B. Shah
 Managing Director (DIN: 00297120)

ASHOKA METCAST LIMITED
 Registered Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mihirkhali Six Road, Ahmedabad 380 006.
 CIN : L70101GJ2009PLC057642

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE HALF YEAR ENDED SEPTEMBER 30, 2021
 (Rs. In Lacs)

Particulars	Half Year Ended		Year Ended
	30-09-2021	30-09-2020	31-03-2021
	Unaudited	Unaudited	Audited
Total Income from operations (net)	3181.62	3281.72	5433.93
Net Profit / (Loss) from ordinary activities after tax	74.11	33.10	12.97
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary Items & share of profit/(loss) of associates)	79.38	36.37	15.34
Equity Share Capital	1071.00	1071.00	1071.00
Reserves & Surplus	1,052.98	1,002.47	978.33
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each)			
Basic	0.74	0.36	0.14
Diluted	0.74	0.36	0.14
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each)			
Basic	0.74	0.36	0.14
Diluted	0.74	0.36	0.14

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE HALF YEAR ENDED SEPTEMBER 30, 2021
 (Rs. In Lakhs)

PARTICULARS	Half Year Ended		Year Ended
	30-09-2021	30-09-2020	31-03-2021
	Unaudited	Unaudited	Audited
Total Income from operations	16.05	220.85	220.91
Net Profit / (Loss) for the period before tax (after Extraordinary and/or Extraordinary items)	-3.56	13.31	-0.45
Profit after tax	-3.56	9.96	-0.38

Notes:
 The above is an extract of the detailed format of Half Yearly Financial Results filed with stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Half Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.ashokametcast.in)

ASHOKA METCAST LIMITED
 SHALIN A. SHAH
 Managing Director
 DIN : 00297447

Arman Holdings Limited
 Registered Office : 419, Rajhans Heights, Mini Bazar, Varachha Road, Surat 395006.
 Tel : 9586066569. Email ID : armanholdingsltd@gmail.com. Website : www.armanholdings.in
 CIN : L65993GJ1982PLC082961

Extracts of Standalone Unaudited Financial Results for the First Quarter Ended 30/9/2021
 (Amt Rs. In Lakhs)

Particulars	3 months ended 30/09/2021		Preceding 3 months ended 30/06/2021		3 months ended 30/09/2020		Half Year ended 30/09/2021		Corresponding Half Year ended 30/09/2020	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Total Income from Operations	110.67	122.18	15.75	232.85	1.65	-3.11				
Profit before exceptional and extraordinary items and tax	0.76	0.89	1.95	1.65	1.65	-3.11				
Profit before tax after extraordinary items	0.76	0.89	1.95	1.65	1.65	-3.11				
Profit/(Loss) for the period from continuing operations	0.76	0.89	1.95	1.65	1.65	-3.11				
Total Other Comprehensive Income / (Loss)	0	0	0	0	0	0				
Profit / (loss) for the period	0.76	0.89	1.95	1.65	1.65	-3.11				
Paid up Equity share capital (Face Value of Rs.10/-each)	521.05	521.05	521.05	521.05	521.05	521.05				
Earnings Per Share (before extraordinary items) (Rs.)										
(a) Basic	0.015	0.017	0.037	-0.060	-0.060					
(a) Diluted	0.015	0.017	0.037	-0.060	-0.060					
Earnings Per Share (after extraordinary items) (Rs.)										
(a) Basic	0.015	0.017	0.037	-0.060	-0.060					
(a) Diluted	0.015	0.017	0.037	-0.060	-0.060					

Notes:
 1. The above results is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the stock exchange website, i.e., www.bseindia.com and company's website, i.e., www.armanholdings.in.

For Arman Holdings Limited
 Deepak Kumar Sabel
 Managing Director
 DIN : 05200110

Date : 13/11/2021
Place : SURAT

REAL STRIPS LIMITED
 Registered Office: Survey No.245-246, Village Sari, Ahmedabad-Bavla Highway, Taluka Sanand, Dist.: Ahmedabad - 382220, Gujarat.
 CIN : L27100GJ1999PLC014383
 Telephone: +91 92280 02011, +91 92280 02012
 Email: ramcharan@realstrips.com Website: www.realstrips.com
 Com. No. Bombay Stock Exchange - 513558

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September 2021
 (Rs In Lakhs except as stated)

PARTICULARS	Quarter Ended		Half Year Ended		Year Ended	
	30.09.2021	30.06.2021	30.09.2020	30.09.2021	31.03.2021	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
Total Income from operations	4,381.35	2,931.25	3,226.53	7,312.60	4,454.20	12,503.01
Net Profit/(Loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	263.39	(17.85)	362.03	245.54	82.47	(1,341.77)
Net Profit/(Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	263.39	(17.85)	362.03	245.54	82.47	(1,341.77)
Net Profit/(Loss) for the period (after tax, exceptional and / or extraordinary items)	263.39	(17.85)	362.03	245.54	82.47	(1,399.63)
Total Comprehensive Income for the period (comprising profit for the period after tax and other comprehensive income after tax)	-	-	-	-	-	18.83
Equity Share Capital (Face value of Rs.10/- each)	597.50	597.50	597.50	597.50	597.50	597.50
Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	(3,062.72)
Earnings Per Share (For Continuing and Discontinued operations) (Amount in Rs.)						
- Basic & Diluted (Not annualised)	4.40	(0.30)	6.05	4.10	1.38	(23.41)

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly/ Half yearly financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Half yearly financial results are available on the websites of the Stock Exchanges and the listed entity (www.realstrips.com).
 2. The Hon'ble NCLT, Ahmedabad Bench vide order dated 09th March, 2021 passed in CP (IB) No. 2021/77/NCLT/AHM2021 initiated the Corporate Insolvency Resolution Process (CIRP) under the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. Mr. Ramchandra Dattaram Choudhary has been appointed as the Resolution Professional (RP) by the Committee of Creditors (CoC). The RP has relied on the assistance provided by the members of the Adjudicating Authority in review of the financial results and certifications, representations and statements made by the directors of the company in relation to these financial statements. The RP has taken on record the financial statements of the company in good faith and in the limited extent of discharging the powers of the Board of directors of the company which has been conferred upon him under Section 17 of the Insolvency and Bankruptcy Code, 2016.
 3. The company had defaulted in the repayment of loan amounting to Rs 7,700.00 Lakhs being principal amount during the period from October 7, 2019 till September 30, 2021 and Rs 1,721.55 Lakhs towards interest during the period from October 7, 2019 till March 9, 2021 to the financial creditor namely Rasraj Metal Industries Limited. Accordingly, Rasraj Metal Industries Limited filed an application before the Hon'ble NCLT, Ahmedabad Bench for initiation of CIRP under the provisions of the Insolvency and Bankruptcy Code, 2016 (the Code) read with the rule 4 of the Insolvency and Bankruptcy Code (Application to the Adjudicating Authority) namely, 2016 to initiate corporate insolvency resolution process against the Corporate Debtor. Further, on March 9, 2021, the Hon'ble NCLT, Ahmedabad Bench had admitted the petition filed by financial creditor for initiation of Corporate Insolvency Resolution process (CIRP) under the Insolvency and Bankruptcy Code, 2016 and appointed Mr. Ramchandra Dattaram Choudhary as the Interim Resolution Professional (IRP). Thereafter, in the first meeting of committee of creditors (CoC) held on 09th April, 2021 the members of the Committee of Creditors approved the appointment of Mr. Ramchandra Dattaram Choudhary having ISBN No. ISBN/IRP/019-PO/015/2017-2018/10326 as Resolution Professional (RP) to carry out the functions entrusted by the provisions of the Insolvency and Bankruptcy Code, 2016, Rules and Regulations thereto. Further, in accordance with the provisions of section 23 of the Code, the resolution professional shall conduct the entire corporate insolvency resolution process and manage the operations of the corporate debtor during the corporate insolvency resolution process period. Further, the resolution professional shall continue to manage the operations of the corporate debtor until an order approving the resolution plan under sub-section (1) of section 31 or appointing a liquidator under section 34 is passed by the Adjudicating Authority.
 4. As per the requirement of the "IBC, 2016" and "CIRP Regulations", the Resolution Professional has invited expression of Interest (EOI) from prospective Resolutions Applicants (PRAs) to submit the Resolution Plan for the Company. The resolution plan received was placed in the third meeting of CoC held on June 25, 2021 and the same was approved by all the members of the CoC with requisite majority through the e-voting process. Accordingly, the Resolution Professional has filed an application for approval of resolution plan under Section 30(6) read with Section 31 of the Insolvency and Bankruptcy Code, 2016 and read along with the Regulation 39(4) of the Insolvency and Bankruptcy Code of India (Insolvency Process of Corporate Persons) Regulations, 2016 and the matter was listed for hearing at Hon'ble NCLT, Ahmedabad Bench on 20.09.2021 where it was further adjourned to 16.11.2021 for further consideration.
 With respect to the unaudited financial results for the six months ended September 30, 2021, the RP has signed the same solely for the purpose of ensuring compliance by the Corporate Debtor with applicable laws, and subject to the following disclaimers:
 a) The RP has signed and furnished the report in good faith and accordingly, no suit, prosecution or other legal proceedings shall lie against the RP in terms of Section 233 of the Code.
 b) No statement, fact, information (whether current or historical) or opinion contained herein should be construed as a representation or warranty, express or implied, of the RP including, his authorised representative.
 c) The RP, in review of the unaudited financial results and while signing this statement of financial results, has relied upon the assistance provided by the directors of the Corporate Debtor, and certifications, representations and statements made by the directors of the Corporate Debtor, in relation to these financial results. The statement of financial results of the Corporate Debtor for the six months ended September 30, 2021 have been taken on record by the RP solely on the basis of and on relying on the aforesaid certifications, representations and statements of the aforesaid directors and the entitlement management of the Corporate Debtor. For all such information and data, the RP has assumed that such information and data are in the conformity with the Companies Act, 2013 and other applicable laws with respect to the preparation of the financial results and that they give true and fair view of the position of the Corporate Debtor as of the dates and period indicated therein. Accordingly, the RP is not making any representations regarding accuracy, veracity or completeness of the data or information in the financial results.
 5. The financial results for the six months ended on September 30, 2021 have been prepared by the management of the Company and certified by Mr. Ramcharan Beriwalla, Chief Financial Officer (CFO) of the Company in accordance with Regulation 33(2) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Rules 2015.
 6. The financial results were placed before the RP, the Chief Financial Officer and the Company Secretary on November 12, 2021 for their consideration. Accordingly, the unaudited financial results were considered and recommended in their meeting. In view thereof, the RP, in reliance of such examination and by the representation, clarifications and explanation provided by the CFO, has signed and certified the financial results for the quarter and six months ended on September 30, 2021. The amount of interest on the balance sheet can also undergo changes based on the Final decision of the Adjudicating Authority.
 7. Had provisions of interest been recognized, finance cost, total expenses, for the quarter and six months ended on September 30, 2021 would have been higher and profit and total comprehensive income for the quarter and six months ended on September 30, 2021 would have been lower by the equivalent amount as mentioned above having consequential impact on other current financial liability and other equity.
 8. As explained in note 3 above, the Corporate Debtor is under CIRP and therefore the company has not taken into consideration any impact on the value of the tangible and intangible assets, if any, in preparation of financial results as required by Ind AS 10 on "Events after the reporting period". Further, the Company has also not made full assessment of impairment as required by Ind AS 36 on "Impairment of Assets" if any, as at September 30, 2021 in the value of tangible and intangible assets. Further, various other items of the balance sheet can also undergo changes based on the Final decision of the Adjudicating Authority.
 9. No deferred tax assets are recognized in the absence of reasonable certainty that taxable income will be generated by the company, for all other losses.
 10. The amounts of inventories are as taken by the management.
 11. The comparative periods presented have been regrouped/reclassified in conformity with the current period classification.

For Real Strips Limited
 (a company under Corporate Insolvency resolution process under NCLT)
 Ramcharan N. Beriwalla
 Chief Financial Officer
 CA Ramchandra Dattaram Choudhary
 Resolution Professional
 IP Registration No. ISBN/RA-0019
 IP-P0015/2017-2018/10326

Place: Sari-Village
Date: 13th November 2021

